


# દાન્ય સાંખ્યાણ



ડૉ. મનુ જ્હપી

જે વ્યક્તિ સ્વયમું પોતાના દર્દને અનુભવી શકે છે, મહેસૂસ કરી શકે છે, સહન કરી લે છે, એ વ્યક્તિ અન્ય કોઈ પણ જીવને કદાપિ દુઃખી કરતી નથી.

જે વ્યક્તિ પોતાના નાનામાં નાના દુઃખના મોટામાં મોટાં રોદણાં રૂબે છે, એ વ્યક્તિને મળતું મોટામાં મોટું સુખ પણ એને થોડામાં થોડું પણ સુખી કરી શકતું નથી.



ડૉ. મનુ જ્હપી

## ૧. મારે કંઈક કહેવું છે

કિસીકી મુસ્કરાહટો પે હો નિખાર  
કિસીકા દર્દ ભિલ સકે તો વે ઉધાર  
કિસીકે વાસ્તે હો તેરે દિલ મેં ઘાર  
જના ઈસીકા નામ હે...

મેડિકલશાસ્ત્રે માનવીના શરીરની અંદરનું અને બહારનું બધું જ, જુદી જુદી પદ્ધતિઓથી માપવાના જાત જતનાં અવળાંદા અને અટપટાં ઓજારો બનાવ્યાં છે.

શરીરનું તાપમાન માપવાનું ફાલતું થમોભિટર, બ્લડ-પ્રેશર માપવાનું ઉબલું, હૃદયના ધબકારા માપવાનું ડોલચું, ઉંચાઈ-વજન માપવાનાં કાંટાઓ, શાસોશ્વાસની ગતિ માપનારાં ભૂંગળાં - લોહી-પેસાબ, થૂંક, સંઝાસમાં શું શું છે ? કેટલું છે ? એ માપવાની અવિશ્વસનીય પદ્ધતિઓ, અરે ગર્ભશયનું કે કરોડરજીજુનું સુંદર પ્રવાહી જેંચીને માપવામાં પણ એમનો હાથ જરાય જેંચાતો જ નથી.

આટલું બધું માપવાનાં ઉપકરણો ઠાંસીઠાંસીને એમની પાસે હોવા છતાં - હજુ સુધી માનવીના શરીરમાં કઈ જગ્યાએ કેટલું દર્દ થાય છે ? એ માપવાનું કોઈ સાધન આ ઉસ્તાદો બનાવી શક્યા નથી. કયા માનવીને ક્યારે કેટલું દર્દ થાય તો એ નોર્મલ કહેવાય ? એની એ ઉફોળો પાસે કોઈ નિશ્ચિત વ્યાખ્યા બાંધેલી નથી.

પરંતુ એમને બરાબર ખબર છે કે સાલું શરીર છે, અને આટલાં બધાં મહાકાય, મહાઅદ્ભુત કાર્યો કરે છે એટલે એને દુઃખાવો તો થવાનો જ. તો શા માટે દુઃખાવાના નામ પર પણ અપની રોટી પકાવી ન લેવાય ?  
એટલે

‘અમે બેઠા છીએ ત્યાં સુધી સાલું તમારું શરીર દુઃખે જ કેમ ? એ સમજે છે શું એના મનમાં ? અમારી પાસે આવો ! અમે તમારા દર્દને ઊગતું જ દબાવી દઈશું જેથી એ વધી જઈને તમને મારી ના નાંખો. અમારી પાસે તમારી ચામડી પર રગડવાના તેજ મલમપણાથી માંડી, ચાકુ, છૂરી, તીરકામઠાં, તલવાર, ભાલા, પીસ્તોલ, રાઈફલ, બોઝોર્સની તોપો ને એટમ બોંબ છે. તમારા દુઃખાવાને લાઈટો આપી ફૂટી બાળવાનાં કે કાપીને ફેંકી દેવાના મહાકાય મશીનો તૈયાર જ છે. અમે તમારા દર્દને દબાવી દેશું, જુદુંબુદું જડ કરી નાંખશું, કચડી નાંખશું, છૂંદી નાંખશું, વીંખી નાંખશું - પીંખી નાંખશું. આખરે અમારું મેડિકલશાસ્ત્ર તમારા ભલા માટે જ તો બનાવ્યું છે ને ?

આ થિયરી પર દર્દ - PAINને મારવાનો - Kill કરવાનો એક મહાભયંકર રાક્ષસી રોકડિયો ઉધોગ ફાટીને ફાળકે ગયો છે. એ પેલા રાક્ષસની માફક રાતે ના વધી એટલો દિવસે વધી છે અને દિવસ કરતાં રાતે વધારે લાંબો થાય છે.

પરીણામે માનવ શરીરના એક અદ્ભુત દિવ્ય અંગ - દર્દને આ રાક્ષસોએ અને એમના દલાલોએ માનવ શરીરનું આજીવન દુશ્મન બનાવી દીધું છે.

દર્દ એ માનવ જીવનની ચોસઠ અદ્ભુત હૈવી લાગણીઓમાંની એક સુંદર લાગણી છે. માનવીએ એના જીવનમાં કષેત્રે કષેત્રે 'માનવી તરીકે જીવવા માટે' એનો પ્રકૃતિજ્ઞન્ય ઉપયોગ કરવાનો છે. દર્દ મહેસૂસ કરવું - અનુભવવું એ દ્રેક માનવીની પોતાની અંગત - Personal ખાનગી પ્રાઈવેટ બાબત છે. એ આખી ભાવનાને આ હરામખોરોએ બદ્ધ કરી છે, અભડાવી મારી છે.

આ દર્દ સામે માંડેલા ભિષળ યુદ્ધમાં મરણતોલ ઘાયલ થઈને છેલ્લા થાસ લેતું દર્દ, સ્વયમ્ભુ ચીસો પાડી પાડીને ફક્ત એક વાત આખી દુનિયાને કહેવા માંગે છે : 'મને દબાવશો નહીં, કચડશો નહીં, મને મહેસૂસ કરતાંની સાથે મારી નાંખશો નહીં !'

સંભળાય છે તમને 'દર્દ'ની દબાયેલી એ ચીસો ?

નથી સંભળાતી ?

ચાલ્યા આવો મારી સાથે સાથે.

'દર્દ દાસ્તાન'ના પાને પાને અને લીટીએ લીટીએ તમને સમજાવું કે દર્દ તમારું દુશ્મન નથી.  
એ એક વિશ્વાસુ, વજાદાર, કદરદાન, સદા હોશિયાર

તમારું આજીવન મિત્ર છે, હિતેચ્છુ છે, શુભચિંતક છે - દોસ્ત છે.

એને દબાવનાર, કચડનાર, બાળનાર, મારનાર કે કાપીને ટુકડા કરનાર સમગ્ર માનવ જીતના શરીરોની અદ્ભુત રચનાના - ઈશ્વરના - કુદરતના જન્મજાત દુશ્મનો છે.



## ૨. દર્દની ઓનેટોમિ

દર્દ મહેસૂસ કરનારા, એનો સંદેશો મગજ સુધી પહોંચાડનારા સંદેશવાહક કોષોને મેરિકલ ભાષામાં ન્યુરોન્સ NEURONS - જ્ઞાનતંત્રાઓ કહેવાય છે. આ જ્ઞાનતંત્રાઓનું એક આખું સુંદર, સુવ્યવસ્થિત, અદ્ભુત ગૂંથળી કરેલું નેટવર્ક આપણા શરીરના અણુએ અણુમાં પથરાયેલું છે. એટલું જ નહીં, શરીરની બહારની દુનિયા સાથે પણ એનો સતત સંપર્ક જળવાયેલો રહે છે. વધુ વિગતો મારાં અવયવ દર્પણ, એન્ટી ટેન્શન, જીવી થેરેપી, ચમત્કારિક ચીકી, નો બી.પી. ઇત્યાદિ પુસ્તકોમાંથી મળી રહેશે.

અહીં ફક્ત જરૂર પૂરતું સંક્ષિપ્તમાં જાણી લઈએ.

જ્ઞાનતંત્રાઓને એક અદ્ભુત સુરક્ષા કવચ કુદરતે પૂરું પાડ્યું છે.

મગજને બખ્તર જેવી મજબૂત ખોપરીમાં ગોઠવ્યું છે. સ્પાઇનલ કોર્ડના ગૂંથળીભર્યી જ્ઞાનતંત્રાઓ કરોડરજીજુના

ફ્લેક્સીબલ છતાં મજબૂત પોલાણમાંથી પસાર થઈ આખા શરીરમાં અંદર અને બહાર ફેલાય છે. મગજ અને સ્પાઇનલ કોર્ડ આઘાત-SHOCKથી ડેમેજ ન થાય એ માટે કુદરતે એ બનેને એક સ્વર્ચ-નિર્મળ પ્રવાહીમાં તરતા રાખ્યાં છે.

જેને દર્દ સાથે સંબંધ છે, તેવા સ્પર્શ-ત્વચાના જ્ઞાનતંતુઓ જોકે સમગ્ર શરીરની ત્વચા પર છૂટથી પથરાયેલા છે. જેમને એટલું મજબૂત સુરક્ષા કવચ નથી પરંતુ કુદરતે આ અછિત ભરપાઈ કરવા માટે એની સંખ્યા એટલા વિશાળ પ્રમાણમાં રાખી છે કે તેજ પેઈન કીલર મલમ, સ્રે કે કાપકુપથી થોડાધણા ઘવાય કે નાશ પામે તો પણ માનવી દર્દ મહેસૂસ કરી શકે છે. જીવનની કાણોકાણ બધી જ વિપરિત પરિસ્થિતિઓમાં સરળતાથી જીવી શકે છે - કેવી રીતે ? આવો એ પણ જોઈ જ લઈએ.



### ૩. આંગળી કપાઈ ગઈ ?

જ્ઞાનતંતુને શાકભાજી શમારતાં શમારતાં ઘારદાર છરીનો એક હળવો લસરકો ડાબા હાથની પહેલી આંગળીને ટેરવેથી સરકી ગયો અને...?

પછી શું થયું એનું એક સ્લો મોશનમાં નિરીક્ષણ કરીએ. આંગળીના ટેરવાની નીચે પથરાયેલા જ્ઞાનતંતુઓને 'કંઈક થયું છે - દુઃખે છે' એવા પ્રકારનું એક સિગનલ

સ્પાઇનલ કોર્ડમાં રહેલી મોટર નર્વ્સ (Nerves)ને વીજળીથી પણ તેજ ગતિએ પહોંચાડ્યું અને પેલી છરી આંગળીને વધુ કાપે - ઉંડી ઉતરે એ પહેલાં તો શાંતાબહેનનો ડાબો હાથ અને ઘારદાર છરી બે એકબીજાથી દૂર થઈ ગયાં.

અહીં એક વાત સમજી લઈએ કે આ છરી અને આંગળીના સંપર્કની કિયા આંખે જોઈ નથી, અને એ અહેવાલ હજુ મગજ સુધી પહોંચ્યો જ નથી. છતાં પણ એક ઓટોમેટિક રીફ્લેક્સની કિયાને કારણે આ શક્ય બને છે.

સ્પાઇનલ કોર્ડમાં પથરાયેલા ઈન્ટર ન્યુરોન્સ - એટલે કે જ્ઞાનતંતુઓના સદા ખબરદાર સહાયકો, દર્દને મહેસૂસ કરનારા સંદેશાઓને સકીય કરે છે, જેને કારણે આંગળી વધારે કપાતી બચી જાય છે - અને એ દરમિયાન જ આ સમગ્ર એક્સીડન્ટની વિગતો મગજ સુધી પહોંચાડવામાં આવે છે. જેના પડ્યા પ્રતિભાવ સ્વરૂપે એક આખું તંત્ર એક ક્ષણના પણ હજારમા ભાગમાં એકદમ જાગૃત થઈ જાય છે. આખા શરીરમાં ફટાફટ સંદેશાઓ અને હુકમો અને એના અમલ શરૂ થઈ જાય છે. આવા સંજોગોને પહોંચી વળવા જે કંઈ જરૂરી છે, તે કરવાનું શરૂ થઈ જાય છે.

આવો એની થોડી વિગત પદ્ધતિસર જોઈ લઈએ.

### Involuntary – અસ્વૈચિક :

છરીની ધાર આંગળીના ટેરવાને કાપતાં જ મોઢમાંની વાચા કેન્દ્ર દ્વારા એક હળવી ચીરા 'આહ' પડાઈ જાય છે.

### Awareness – જાગૃત રહો :

શરીરનાં અણુઓ અણુ અને અવયવે અવયવ, સમગ્ર ગ્રંથિઓ સાબદાં થઈ જાઓ અને શરીરની અંદર જે કંઈ કરવું જરૂરી છે તે કરવાનું શરૂ કરી ધો. લોહીને ગંઠાવી ધો. જખમ આગળ રોગના જંતુઓના પ્રતિકારક કોષોને તૈનાત કરી ધો. ગ્રંથિઓને કહો કે શરીરના રક્તભ્રમણમાં દર્દશામક પદાર્થો Inbuilt Pain Killers વહેતા મૂકે.

### Hightened Awareness – વધુ જાગૃતિ :

મગજનું કોટેક્ષ આ સંદેશામાં વધુ ઊંડી તપાસ કરે છે અને વિગત વાર જણાવે છે : 'હા જખમ થયો છે પણ ખાસ ગભરાવા જેવું નથી. દુઃખાવો થાય છે પણ સહન થાય છે, લોહી નીકળે છે. થોડી તકલીફ પણ થાય છે.'

### Questions – પ્રશ્નોત્તરી :

કોટેક્ષને વિવિધ દિશાએથી મળેલા સંદેશાઓના પરિણામે મગજમાં પ્રશ્નોત્તરી થાય છે.

૧. આમ કેમ થાય ? ૨. શાક તો રોજ સમારે છે.
૩. આંગળી ઊંડી કપાઈ છે ? ૪. લોહી કેટલું વહી ગયું છે ? ૫. વિગત વાર તપાસ કરો.

### Purposeful Response : હુકમ કી તામિલ હો :

આંગળી ઊંચી કરો, નજર કરો, રિપોર્ટ આપો.

### Observation જાંચ-પડતાલ :

કોટેક્ષ રિપોર્ટિંગ સર !

૧. છરીને હમણાં જ નવી ધાર કાઢી હતી, પણ મામલો ગંભીર નથી. બધું કાબૂમાં છે.

આ છેલ્લા સમાચારથી શરીરનું સમગ્ર જાગૃત થયેલું તંત્ર હાશકારો અનુભવે છે. તંગ થયેલા સ્નાયુઓ ઢીલા પડે છે. કોઈ ખોટી ધાંધલ થતી અટકી જાય છે.

Evaluation – જખમનો અંદાજ આવી ગયા પછી મગજ હુકમ છોડે છે.

૧. હૃદયના ધબકારા પાછા નોર્મલ થઈ જાઓ.
૨. બ્લડપ્રેશર નોર્મલ થઈ જાય.
૩. શાસોશાસ પાછા નોર્મલ પર આવી જાય.
૪. એડ્રેનલ ગ્રંથિઓ, પીચ્યુટરી બધા જૈસે થે !!

### Voluntary Orders - Conscious સ્વૈચ્છિક હુકમો જાગૃત મન :

હવે અહીંથા થોડી ગરબડ થાય છે. તમારી સામાન્ય બુદ્ધિ લગભગ કરવા જેવું બધું જ કરવા માગતું હોય છે. આવી પરિસ્થિતિમાં અન્ય જીવો કરે છે તેમ બીજા કોઈની ચમચાગીરીની સલાહની કે મદદની જરૂર હોતી જ નથી. પરંતુ માનવી જરા વધારે પડતો દોઢાછો છે અને જહેરખબરિયા અને સારવારિયાઓએ એની છઢી ઈન્જિયને જુઢી-બુઢી, જરૂર અને ભષ્ટ કરી છે. એટલે એ ન કરવાનું

કરે છે.

૧. કાબોલીક એસીડવાળા એન્ટીસેપ્ટિક રગડાય છે.
૨. વિષારી ચીકણા મહમોના લપેડા થાય છે.
૩. અક્કલ વગરની હળદરવાળી પટ્ટીઓ ચોટાય છે.
૪. એન્ટીસેપ્ટિક, એન્ટીબાયોટિક્સ અને એનાલજેસિક્સની ગોળીઓ મુઢી ભરીને ગળાય છે.

બધું જ ન કરવાનું થાય છે અને પરિણામે જખમ બે દિવસમાં રૂઆવાનો હોય તો બાવીસ દિવસ લાગે છે.

### STORAGE DATA FOR FUTURE

#### લાંબાગાળાની યાદદાસ્તમાં સંગ્રહ

આવો અક્સમાત બીજી વાર ન થાય એ માટેની માહિતી મગજમાં ફાઈલ થઈ જાય છે.

\*                  \*                  \*

જ્યારે જ્યારે શરીરને આવી નાની મોટી કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, ત્યારે લગભગ બધું જ પોતાની મેળે થઈ જ જાય છે. આખી દુનિયાના જીવો, આવી પરિસ્થિતિમાં પોતાના શરીરની રચના સાથે એક સંવાદની આપ-લે કરે છે અને એકબીજાની ભાષા સમજીને બધું જ આપમેળે કરે છે.

એક માનવીને ફક્ત પોતાના શરીરની અદ્ભુત રચના સાથે કદાપિ સંવાદ કરતાં આવડતો નથી. એ બતે એક-બીજાની ભાષા સમજ શકતા નથી. એ સમજતા હોય અને

સાંભળવી હોય તો દુનિયાભરના જાહેરબરિયાઓના ભૂંગળાં અને સારવારિયાઓના રાગડા એમને આ વાત સાંભળવા દેતા નથી.

આવા સાવ સાદા જખમમાંથી જ પછી એ જખમો પાકે છે, ડાયાબીટીસનાં લેબલો આણવન કપાળે ચોટે છે, ટેટેનસ અને ગેંગરીન જેવી બીમારીઓ ઘૂસી જાય છે, આંગળીઓનાં એમ્બ્યુટેશનો પણ સાવ સહજ રીતે થઈ જાય છે.

□

### ૪. વ્યવસાયિક વફાદારી

હાર્વર્ડ યુનિવર્સિટીના એનેસ્થેસિયાના પ્રોફેસર ડૉ. હેન્રી બીચર કહે છે :

#### ‘ભાવાનુવાદ’

‘બીજા વિશ્વયુદ્ધમાં ઇટલીમાં જે સૈનિકો શારીરિક રીતે ઘાયલ થયા હતા, એમાંના ચોથા ભાગના સૈનિકોએ પોતાના જખમના દુઃખાવાની ન તો ફરિયાદો કરી હતી કે દુઃખાવો શમાવવા માટે કોઈની મદદ માંગી હતી. આમાંનો એક પણ સૈનિક બેહોશ ન હતો કે એને કોઈ માનસિક શોક SHOCK લાગવાથી જડ પણ નહોતો થયો. સામાન્ય પણ આવા ઘાયલ સૈનિકોને એક રૂટિન તરીકે દર્દશામક મોર્ફિયાનાં ઈજેકશનો આપવામાં આવે છે એ પણ આપવામાં નહોતાં આવ્યાં.’

## આમ કેમ ?

ડૉ. હેત્રી કહે છે : 'આ ગંભીર રીતે ઘવાયેલા સૈનિકોમાંના ઘણા જવાનો તો પોતે શારીરિક રીતે કાયમના અપંગ થયેલા હોવાથી હવે લશ્કરમાંથી ઘેર જવા રજી મળશો અને ફરી વાર યુદ્ધ લડવાની ફરજ નહીં પાડવામાં આવે એવી ભાવનાથી દુઃખની ચીસો પાડવાને બદલે આનંદ-ખુશાલી વ્યક્ત કરતા હતા.

આની સરખામણીમાં ડૉ. હેત્રી કહે છે કે સામાન્ય ઓપરેશન કરાવેલા દર્દીઓમાંના પોણા ભાગના દર્દીઓ ફક્ત પોતે 'ઓપરેશન કરાવ્યું છે એટલે દુઃખાવો થવો જ જોઈએ' એમ નિશ્ચિત સ્વરૂપે માનતા હોય તેમ, ઓપરેશન પછીના મહિનાઓ સુધી સતત દુઃખવાની (ખોટી ખોટી-કાલ્યનિક) ફરિયાદો કરતા હોય છે અને આ સાવ ખોટા દુઃખવાને શમાવવા (?) ડોક્ટરો ભારેખમ-નુકસાન કરે તેવી કે આદત પાડનારી દર્દનાશક દવાઓની ગોળીઓ કે ઈજેક્શનો આપતા હોય છે.

વ્યવસાયિક વફાદાર ડૉ. હેત્રી પોતાનું અમૂલ્ય મંતવ્ય રજૂ કરતાં કહે છે કે, આવા બનાવટી કાલ્યનિક દર્દો મટાડવા માટે ડોક્ટરોએ એવા દર્દીઓને બનાવટી દર્દનાશક ખોટી ખોટી નુકસાન ન કરે તેવી જ દવાઓ આપવી જોઈએ. (અંગ્રેજીમાં આવી દવાઓને PLACEBO TREATMENT કહે છે) દર્દીને પોતાને ડોક્ટર 'કંઈક' આપશે એટલે સારું

થંડ જ જશે એવી જે માન્યતા ધરાવતો હોય છે, વિશ્વાસ રાખતો હોય છે, એ ભાવનાનું સંપૂર્ણ રીતે પાલન કરવું જોઈએ.



## ૫. પંચાતિયાઓની જમાત

શરીરના કોઈ એક ભાગમાં દર્દ થાય છે અને દર્દી પોતે એનો પોતાની સમજ પ્રમાણે ઘરગથ્થુ ઈલાજ કરી દર્દમાં રાહત મેળવવા પ્રયત્ન કરે છે, ત્યાં સુધી ખાસ આફતો તૂટી પડતી નથી.

પરંતુ દર્દી પોતે આવું કંઈક કરે એ પહેલાં જ આખા ઘરનાં, અડોસપડોસનાં, શેરી કે મહોલ્લાનાં, સગાંવહાલાં કે ઓફિસનાં - બદ્ધ બદ્ધાં જ નવરાં ફુટકલિયા માનવીઓ - પેલા દુઃખાવો થયેલા માનવીની પાછળ રીતસર સવાશેર સૂંધ ખાઈને પડી જાય છે.

'અરેરે - કોઈને બતાવતો કેમ નથી ?'

'ફોટો કઢાવી લે - ખબર પડી જશે !'

'હજુ શરૂઆત છે - પાછળથી વધી જશે !'

'ગાંઠ હશે - પાકી જશે - શાટી જશે - મારી નાખશો.' વિ. વિ. વિ.

સર્વપ્રથમ શરીરને દર્દ થાય જ કેમ ? એનાં કારણો ગમે તેમ કરીને શોધી જ કાઢવાં, અને એ કારણને જ

મૂળમાંથી દબાવી દેવું - ઉખેડિને ફેંકી દેવું એટલે 'ન રહે  
બાંસ ન બજે બાંસુરી' - સાલ્વનું દઈ ગાયબ થઈ જ જાય.

દઈ પોતાની અને કુરસદિયા પંચાતિયાઓની આ  
કુટકલિયા સાયકોલોજી લઈને જ્યારે દઈની સારવાર કરાવવા  
જાય છે, તે ઘડીથી જ એની પાયમાલીના શ્રીગણેશ મંડાઈ  
જાય છે.

દરેક માથાનો દુઃખાવો બ્રેઇન ટ્યુમર થઈ શકે છે.

દરેક ગળાનો દુઃખાવો કેન્સરમાં પલટાઈ જાય છે.

દરેક છાતીનો દુઃખાવો બાયપાસના દરવાજા ખોલે છે.

દરેક ફેફસાનો દુઃખાવો ટી.બી. કે કેન્સર બની જાય છે.

અરે પેટનો દુઃખાવો ? બાપરે બાપ -

પચ્ચીસ-પચાસ રિપોર્ટો અને પચ્ચીસ-પચાસ હજાર  
ગટરમાં નાંખ્યા પછી જેટલા સ્પેશીયાલીસ્ટો એટલી બીમારીઓ  
- લીવર બગડે, ગોલ બ્લેડરમાં પથરા થઈ જાય, જદર  
આંતરડામાં ચાંદા પડી જાય, ગાંઠો બંધાઈ જાય, ટીબી થાય,  
અપેનીક્સ કપાઈ જાય, ગભર્શિયમાં તો એક એક કરીને  
આખું ગભર્શિય બહાર નીકળી જાય.

પછી પીઠ શું કામ બાકી રહી જાય ? ગરદનના  
મણકાથી માંડી આખી કરોડરજજુના મણકાની ગાઢી દબાઈ  
જાય, મણકા ખસી જાય, સ્પોન્જ્યુલાઈટીસનાં લેબલો લાગી  
જાય, નાના મોટાં ઓપરેશનો પછી હાલત બગડે એટલે  
ન્યુરો સર્જનોની ભરાવદાર ભારેખમ એન્ટ્રી થાય. 'અરે દુઃખાવો ?

ક્યા ચીજ હે - અમે બેઠા છીએ કોના માટે ?'

કમ્મરના દુઃખાવાની કથનીઓના કરુણ પાત્રોમાં  
ડાયાલીસીસથી કીડની ટ્રાન્સ્ફ્લાન્ટ સુધીના અભાગિયાઓનો  
સમાવેશ થાય છે. મેરિકલ સાયન્સે આવડી મોટી ખાસ  
કીડનીની હોસ્પિટલો આખીર બનાવી છે કોના માટે હે ?

પછી બાકી રહી જાય છે ખબા, હીપ - ધૂંટણ કે  
કોષી - ધૂંટીનાં સાંધાના મિજાગરાં.

પંચોતેર વર્ષના કાચા કુંવારા મહોદયોનાં ઢીંચણનાં  
કટાયેલાં મિજાગરાં અમે બદલી આપીશું. અમેરિકા કંઈ  
અમથા ગયા છીએ. હદ્ય જેવું હદ્ય બદલી શકાય તો  
ધૂંટણનું મિજાગરું કૌનસી ઝડ કી મૂલી હે ???

અમારી પાસે નહીં આવો તો અમે તમારી પાસે દોડતા  
આવીશું. અમારી કંપનીના નોબલ ગ્રાઈઝ જીતનારા વેશાનિકોએ  
નોન-ધીસેબલ. ચણકતાં નવાં નક્કોર મિજાગરાં બનાવ્યાં છે.  
તમારાં ધીસટ મિજાગરાં કાઢી ભંગારમાં નાંખી નવું નક્કોર  
ફીટ કરી આપીશું કે તમારી બુઢી ઘોડીને લાલ લગામ લાગી  
જશે ન ઉરબી રેસમાં પહેલો નંબર લાવશે.

હે ભગવાન ! દઈને શમાવવા માટે લાખ્યો રૂપિયા  
ખરચીને રિબાઈ રિબાઈને જવતા અને કમોતે મરતા  
માનવીઓને સદ્દબુદ્ધિ આપો !



## ૬. જાણીએ છીએ - જણાવવું નથી

ડોક્ટરી અભ્યાસ દરમિયાન શરીરની આંતરિક સાવ કરતી ગ્રંથિઓ (Endocrine Glands) વિષે જે કંઈ શિખવાડવામાં આવે છે એનો એક અંશ પણ સામાન્ય માનવીને એની તકલીફ વેળાએ જણાવવામાં આવે તો એ કદાપિ પોતાની તકલીફ મટાડવા વિષારી દવાઓ ખાઈ એ ગ્રંથિઓને બગાડવાની ગુસ્તાખી ના કરે. વિશેષતઃ દુઃખાવો મટાડવા કે શમાવવા તો એ દવાઓ ના જ ખાય.



## ૭. આંતરિક દર્દશામકો

(IN-BUILT PAIN KILLERS)

*ENKEPHALINS* એ થીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ માથામાંથી ભોજમાંથી આવવું.

આ પરથી ઉત્તરેલો શબ્દ છે *ENDORPHINE*. એન્ડોર્ફિન એ મોર્ફિયા જેવો માદક-નશીલો, દર્દનાશક પદાર્થ છે જે શરીરની મગજ અને એની સાથે સંકળાયેલી પીટચુટરી અને એન્સેનલ જેવી ગ્રંથિઓ બનાવે છે અને જ્યારે જ્યારે માનવીના શરીરમાં કોઈપણ શારીરિક કે માનસિક કારણોસર દર્દ થાય છે, તેને શમાવવા આ એન્ડોર્ફિન નામનો પદાર્થ રક્તભ્રમણમાં વહેતો મૂકે છે જેથી પેલું દર્દ આપોઆપ શમી જાય છે.

આ સિવાયના અન્ય ત૦ થી ત૫ જુદા જુદા પ્રકારના હોર્મોન્સ જેમાં સ્ટેરોઇડ્ઝ *STEROIDS* જેવા પદાર્થોનો સમાવેશ થાય છે, તે ફક્ત દર્દને હળવું કરવામાં જ મદદરૂપ થવા ઉપરાંત જખમમાં સંભાવિત લાગનાર ચેપ *Infection*ને રોકવામાં, સારું કરવામાં, માર વાગવાથી ઉપસેલો સોજો *Inflammation* ઉતારવામાં, ફાટેલી-ચિરાયેલી ચામડીને સાંધવાની કિયામાં કે તૂટેલા હાડકાને પાછા જોડવાની અગત્યની કિયાઓમાં ખૂબ જ મહત્વનો ફાળો નોંધાવે છે.

દરેક દરેક ક્વોલીફાઇડ સારવાર કરનારો આ હકીકત સારી રીતે જાણવા છતાં કોઈ પણ દર્દને ભૂલમાં પણ આ વાત જણાવતો નથી. એટલું જ નહીં, જ્યારે જ્યારે આવા વિવિધ કારણોસર દુઃખાવો થાય છે, ત્યારે ત્યારે સાવ બિનજરૂરી, અકુદરતી, નુકસાનકારક, સીન્થેટિક પેઇનકીલર્સ કોટીકોસ્ટેરોઇડ્ઝ, એન્ટી ઇન્ફ્લેમેટરીઝ, એન્ટી સેપ્ટીક્સ, એન્ટી બાયોટિક્સ ખાવા માટે પેશાન્ટને મજબૂર કરે છે અને એની આડઅસરો વિષે જણાવવાનું પણ સૌજન્ય દાખવતો નથી.

પરિણામે સર્વપ્રથમ તો માનવીના શરીરની તૂટકૂટ, રીપેર કરવાનું, દર્દ શમાવવાનું આખું એક અદ્ભુત મેકનીઝ છે એ ખોરવાઈ જાય છે. જુહું-બુહું થઈ જાય છે, ઈમરજન્સીમાં ઉપયોગમાં આવતું નથી.

બીજું આવી રીતે આડેઘડ, સારાસારના વિવેક વિના પ્રમાણભાન જાળવ્યા વિના ખવડાવેલી રસાયણિક દવાઓની

૨૦ \* દર્દ દાસ્તાન

આઉઅસરોને કારણે શરીરના અદ્ભુત, સુંદર, આજીવન કાર્યક્ષમ રહેવા માટે સર્જિયેલા અવયવો હંમેશ માટે કદાપિ રીપેર ન થઈ શકે તેવા તેમેજ થાય છે. આ બધા અવયવોમાં મુખ્યત્વે હદ્ય, મગજ, ફેફસાં, લીવર, કીડની, એન્ઝેનલ, પેન્કીયાઝ, થાયરોઇડ, જઠર, આંતરડાં અને પ્રજનન અવયવોનો પણ સમાવેશ થાય છે.

રે વિજ્ઞાન, તારા પાપે !!!



## c. દર્દશામકો - PAIN RELIEVERS દર્દનાશકો - PAIN KILLERS

દર્દમાં તાત્કાલિક રાહત આપનારી દવાઓમાં સામાન્ય-પણે પેઈનબામ, આયોડીન મલમો, ઇન્સ્ટન્ટ સ્રે, માલિસની દવાઓ ઈત્યાદિનો સમાવેશ થાય છે. જેમાં સામાન્યતઃ ચામડી પર લગાડવાથી ચચરે, જલન થાય, જૂઠી પડી જાય એવી દવાઓ ઉમેરાય છે.

ઉદાહરણ : ટરપેન્ટાઇન, ચાનું તેલ, મેથીલ સેલીસ્લેટ, મેન્થોલ, યુકેલીપ્ટસ, ફુદીનાનું તેલ, કપૂર, મરચું કે મરી જેવા પદાર્થો વપરાય છે.

હવે તો તાત્કાલિક રાહત આપનારા મલમો કે સ્રે પણ પચાસ વખ્તો પૂર્વે બે-ત્રણ રૂપિયામાં મળતા હતા તેમ નથી મળતા. હવે આવા મલમો કે સ્રે સોથી માંડી હજાર

રૂપિયા સુધીના મળે છે. જેમાં ગાંજો, અઝીણ, મોર્કિયા જેવા નશીલા પદાર્થો છૂટથી નાખવામાં આવે છે.

હવે તો ગાંજો અને અઝીણ જુનવાણી થઈ ગયાં. Outdated બની ગયાં. આખી દુનિયામાં નિતનવા નશીલા પદાર્થોનો રોકડિયો ઉઘોગ કોઈના કંટ્રોલમાં રહ્યો નથી. એટલે નાના ભૂલકાઓની ચોકલેટ, પીપરમીટ કે ચ્યુર્ડ્ગગમમાં નશાની ચીજો ઉમેરાતી હોય તો, પેઈન બામમાં શા માટે નહીં? અરે શરીર પર લગાડવામાં આવતાં પાવડર, લોશન, કીમ કે સાબુ, શેખ્પુ કે લીપ્સ્ટિક પણ હવે આમાંથી બાકાત રહ્યાં નથી.



## c. એક અંદાજ

એક સાધારણ અંદાજ મુજબ બજારમાં વેચાતી કુલ ફક્ત એલોપેથીની જ એક લાખ ઔષ્ણિઓમાંની પચીસ ટકા, એટલે કે ૨૫૦૦૦ દવાઓ ફક્ત પેઈન કીલર હોય છે.

આમાં નુકસાન કરે તેવી, ડોક્ટરના પ્રીસ્ક્રીપ્શન સિવાય ન મળે તેવી દવાઓ અંદાજે ૫૦૦૦ બાંડ કરીએ તોપણ બાકીની ૨૦,૦૦૦ દવાઓ OVER THE COUNTER (એટલે કે OTC) જે કોઈપણ ગ્રાહક કેમિસ્ટરીની દુકાને પૈસા આપીને ખરીદી શકે અને મરજીમાં આવે તેમ વાપરી શકે તેવી હોય છે. આમાંની નેવું ટકા બનાવટોનું વેચાશ ભામક

જહેરખબરો દ્વારા થાય છે.

એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રમાણે આખી દુનિયામાં વેચાતી બધી જ દવાઓના પચીસ ટકા દવાઓ બનાવતી (SPURIOUS) ગુણવત્તામાં હલકી (SUB STANDARD) અને ઘણી વાર આદતો પાડે તેવી કે મારી નાંજે તેવી KILLER DRUGS હોય છે.

એટલે સ્વઉપચાર તરીકે દર્દ મટાડવાની, લગાડવાની, ખાવાની કે સુંઘવાની કોઈપણ દવા માનવીને નશાનો આદી બનાવી શકે છે, મગજને નુકસાન કરી શકે છે કે મારી પણ શકે છે.

આવી દવાઓનાં હોલસેલમાં પરિણામો આવે છે, અને ઊહાપોહ થાય છે ને ઊંઘતી સરકાર એના પર પ્રતિબંધ મૂકે છે. એ પહેલાં લાખો કરોડો નિર્દોષ માનવીઓની જિંદગીઓ પાયમાલ થઈ ગઈ હોય છે.



## ૧૦. પેઇન કીલર્સ આર બ્રેઇન કીલર્સ

દુઃખાવો એ શરીરનો નહીં પરંતુ મગજનો વિષય છે.

હાઉંક તૂટીને બે ટુકડા થઈ જાય અને ભયંકર દુઃખાવો થાય ત્યારે ડોક્ટર જે પેઇન કીલરની ગોળી કે ઈજેક્શન આપે એનાથી મગજમાં રહેલો દુઃખાવો મહેસૂસ કરવાનું

કેન્દ્ર જડ-જુંબું થઈ જાય. એટલે દુઃખાવાનો સંદેશો એ કેન્દ્ર સુધી પહોંચે નહીં. મગજ દુઃખાવો FEEL ના કરે – પેલું તૂટેલું હાઉંક તો તૂટેલું જ હોય અને રહે – એ પેઇન કીલરો લેવાથી સંધાઈ ના ગયું હોય.

એવી જ રીતે મૂળો માર વાગ્યો હોય, ચામડી છોલાઈ કે કપાઈ ગઈ હોય, સ્નાયુઓની ખેંચતાણ થઈ હોય, ઔપરેશનની કાપકૂપી થઈ હોય – આ બધામાં જે તૂટકૂટ થઈ હોય તે જેમની તેમ જ હોય. ફક્ત એ દુઃખાવાનો સંદેશો મગજ સુધી પહોંચી ના શક્યો હોય.

હવે મગજને તો ઈશ્વરે, કુદરતે, માનવીને ક્ષણે ક્ષણે ઉપયોગમાં આવે એ માટે સતત જાગૃત રહેવા માટે બનાવ્યું છે. ભરણિંઘમાં પણ એ તો સતત જાગૃત જ રહે છે અને આપણી જાણ બહાર પોતાનું કામ કર્યે જાય છે. વળી દુઃખાવાની ગોળી મગજને વધારેમાં વધારે બે કલાક જૂઢું કરે. ઈજેક્શન ચાર કલાક તો ઘેનની ગોળી કે ઈજેક્શન આઠ કલાક મગજ જૂઢું કરે. એટલે આટલા સમય દરમિયાન દુઃખાવો મહેસૂસ ન થાય. પરંતુ પેલી દવાઓની અસર ઊતરી જાય એટલે પરાણે દબાવીને રાખેલો દુઃખાવો બમણા. જોરથી મગજ પર હુમલો કરે. દર્દી દર્દીથી ચીસો પાડે એટલે પાછી બુમાબુમ અને દીઝાદોડી શરૂ થઈ જાય :

‘અરે દર્દીને દરદ થાય છે. કોઈક કંઈક આપો જલદી કરો.’

પછી વધારે પાવરક્ષૂલ બ્રેઇન કીલર અપાય, મોટી માત્રાઓ અપાય, વધુ કલાકો, દિવસો ઘેનમાં પસાર થાય. આ સિલસિલો પેલું દર્દનું અસલ કારણ ઠીક ન થાય ત્યાં સુધી ચાલ્યા કરે. આ દરમિયાન પેઇન કીલરોં બ્રેઇનને લગભગ નશામાં તુબાડી દીધું હોય અને જ્યારે ટેવ મુજબ એનો ક્વોટા ના મળે એટલે હાથપગ ખેંચાય, લાળ પડે, ધુજારી વધૂટે, ચક્કર આવે, પસીનો વધૂટે, યાદશક્તિ ખોરવાઈ જાય એટલે ?

એટલે આ બધી નવી જ બીમારીઓ છે, એમ ઠસાવી બીજા પાંચપચીસ રિપોર્ટો કઢાવાય, દવાઓ ખવડાવાય અને પેલા અભાગિયા દર્દ મારવાવાળા દર્દનું મગજ હંમેશને માટે સાવ મુફ્ફલીસ, નાલાયક, નકામું બની ગયું હોય.

### યાદ રાખો

દર્દને મારવું એ મગજને મારવા બરાબર છે.

**KILLING THE PAIN  
IS KILLING THE BRAIN**

Q. E. D.



### ૧૧. ફ્યુઝ - FUSE

‘મારાથી સહન નથી થતું ત્યારે જ હું ગોળી ગળું છું.’ કુદરતે દરેક માનવીની સહનશક્તિની કેપેસીટી અલગ

અલગ બનાવી છે, પરંતુ ધીરે ધીરે એ સહનશક્તિને કેળવી (Develop) શકાય છે.

ઉદાહરણ વેઇટ લીફ્ટર, બોક્સર, રેસ્લર ઈ.

જોકે જબરજસ્તીથી વિકસાવેલી આવી સહનશક્તિ-વાળાઓની પાછલી જિંદગી ખૂબ જ દ્યાજનક હાવતમાં વીતે છે એ પણ એટલું જ સત્ય છે.

આવો એ સહનશક્તિને જરા નજીકથી ઓળખીએ.

રસ્તા પર એક એક્સ્પ્રીડ્ન્ટ થાય છે, જેને રસ્તા પરથી પસાર થતા સો-બસો માણસો નજરે જુઓ છે.

આ બસો માણસોમાંનો એકાદ સ્ત્રી કે પુરુષ ફક્ત આ અક્સમાતને નજરે જોઈને માનસિક આઘાત SHOCK અનુભવે છે, કે વધુ ન જોવું પડે એ માટે એ ક્ષણમાં જ બેહોશ થઈ જાય છે.

ઇલેક્ટ્રિકના સ્વીચ બોર્ડમાં એક ફ્યુઝ હોય છે. ઘરમાંના રેફીજરેટર કે ગીજરમાં થરમોસ્ટેટ કંદ્રોલ હોય છે. જેનું કામ કેપેસીટી કરતાં વધુ લોડ આવે ત્યારે બંધ પડવાનું કે સંદર્ભ ઉડી જવાનું છે.

બરાબર આવી જ કંઈ કિયા મગજની રચનામાં પણ કુદરતે કરેલી છે.

મેડિકલશાસ્ત્ર એ પણ સારી રીતે જાણો છે કે ક્ષણભર મૂળીત થયેલા કે સાવ બેહોશ થયેલા માનવીઓ પોતાની મેળે, કોઈની પણ મદદ કે દવાઓ વગર ફરી એક વાર

હોશમાં આવે જ છે.

અરે એનેસ્થેસીયા આપી અકુદરતી રીતે જબરજસ્તીથી બેહોશ કરેલો દઈએ, ઓપરેશન પૂરું થયા પછી થોડી વારે પોતાની મેળે હોશમાં આવે જ છે.

તો ? તો ? તો ?

'મારાથી સહન થતું નથી.' એમ ફરિયાદ કરનાર દઈને ડોક્ટર એમ સમજાવીને કેમ કહેતો નથી કે :

'તું હજુ સુધી બેહોશ નથી થયો. એ જ પુરવારે કરે છે કે તારાથી સહન થાય છે અને તારી સહનશક્તિની હંદ પૂરી થશે ત્યારે તું આપોઆપ બેહોશ થઈ જઈશ. ત્યારે પણ તારે ફીકર કરવાની નથી, કારણ ફરી પાછો તું પોતાની મેળે હોશમાં પણ આવી જ જઈશ.'

પરંતુ આવું કંઈ કોઈ કહેતું જ નથી. કારણ ?

કારણ પછી પેલા પેઈન કીલર બનાવનાર, વેચનાર અને ખવડાવનાર બધા જ સાલ્વા રાતોરાત બેકાર થઈ જાય ન ?



## ૧૨. સિફ એક હી ટીકીયા કાઢી છે

(આપકો મારને કે લીયે)

એસ્પીરીન

૧૮૫૭માં ચાર્લ્સ જરાર્ડ નામના ફેન્ચ કેમિસ્ટ્રે સેલીસીન

Salicin નામના રસાયણમાંથી સેલીસીલિક એસીડ (Salicylic Acid) નામનો પદાર્થ બનાવ્યો. એમાં થોડા સુધારા વધારા કર્યા બાદ આજની જે એસ્પીરીન નામે ઓળખાય છે, તે એસીટાઇલ સેલીસીલિક એસીડ (Acetyl Salisyllic Acid) નામની દવા બની. ઈ.સ. ૧૮૮૭માં FEIEDRICH BAYER નામની જર્મન કંપનીએ એસ્પીરીનને દુનિયાભરના ઘર-ઘરમાં ઘુસાડવાનું પુરુણું કાર્ય કર્યું. જેનો ગ્રબાવ આજે એકવીસમી સદીમાં પણ આપણે અનુભવી રહ્યા છીએ.

હળવામાં હળવી, સાવ નિર્દોષ લાગતી અને બાળકોને પણ છુટથી ખવડાવવામાં આવતી આ ચમત્કારિક દવાના દર્દ મટાડવા સિવાયના ચમત્કારિક પરાકમો પર એક નજર કરીએ.

## SIDE EFFECTS OF ASPIRIN

એસ્પીરીનની આડઅસરો

૧. જઠર, આંતરડાં અને પાચનકિયાને ખોરવી નાંખે.
૨. આંતરડામાં આંતરિક રક્તસ્વાવ થાય.
૩. ચામડી પર રુક્ષતા આવે. લાલ લાલ ઢીમડાં ઊપસી આવે.
૪. વધુ પડતો પરસેવો છૂટે. હાથપગ ઢીલા પડી જાય.
૫. શરીરમાં મીઠાનું પ્રમાણ ઘટી જાય. બી. પી. ઓછું થઈ જાય.
૬. એસીડિટી, હાયપર એસીડિટી, પિતપ્રકોપ અને અલ્સર થાય.

૭. ઉબકા આવે, ઉલટી થાય, જાડા થઈ જાય.
૮. કાનમાં સીસોટી જેવી ચીસો સંભળાય, બહેરાશ આવે.
૯. માથાનો દુઃખાવો થાય. (જેને મટાડવા દવા લેવામાં આવે છે.)
૧૦. ખાસોખાસની કિયા તેજ થઈ જાય, ખોરવાઈ જાય.
૧૧. લોહીમાં એસીડીનું પ્રમાણ વધી જાય.
૧૨. તાવ આવે. (જેને ઉતારવા આ ગોળી લેવામાં આવે છે.)
૧૩. ખોટી ખોટી તરસ લાગે, શોષ પડે.
૧૪. નજર ધૂંઘળી બની જાય.
૧૫. હૃદયના ધબકારા ધીમા પડી જાય.
૧૬. બેચેની લાગે, ડિપ્રેશન આવે.
૧૭. હેલ્યુસીનેશન્સ - જાગૃત અવસ્થામાં ભયાનક ભમણાઓ થાય.
૧૮. મગજની ત્વરિત નિષ્ઠય લેવાની શક્તિ બુઝી થઈ જાય.
૧૯. સ્ટુપર = અર્ધબેહોશી આવે.
૨૦. કોમા - સંપૂર્ણપણે બેહોશ થઈ જવાય.
૨૧. આંકડી-ફીટ-કન્વલ્યુન્સ આવે.
૨૨. રક્તભ્રમણની કિયા ખોરવાઈ જાય.
૨૩. શ્વસન કિયા બંધ પડી જાય.
૨૪. શરીરમાં હોમોન્સનું સમતુલન ખોરવાઈ જાય.

૨૫. યુરેમિયા કીડનીના કોષો તેમેજ થવાથી લોહીમાં કારો વધી જાય.
૨૬. પેશાબમાં રુકાવટ થાય.
૨૭. ચામડીની સંવેદના જૂઠી પડી જાય.
૨૮. શરીરના આંતરિક અવયવો સૂજી જાય.  
સામાન્યપણે બજારમાં મળતી એસ્પીરીન પાંચ મિલિગ્રામની હોય છે.

ત્રણ ગ્રામ જેટલી એસ્પીરીન બતે કીડનીને કાયમ માટે ખરાબ કરી શકે છે.

દસ ગ્રામ જેટલી એસ્પીરીન સાજા-સારા-તંદુરસ્ત જવતા માણસને મારી શકે છે.

Ref : Drugs & Therapeutic Encyclopaedia.  
આટલું વાંચ્યા પછી બીજી વાર દર્દનાશક ગોળી લેતાં  
પહેલાં એની આડઅસરો વિષે જાણી લેવાની સલાહ છે.  
અન્યથા એની આડઅસરો ભોગવવાની તૈયારી રાખવાની  
ભલામણ છે.

ઈતિશ્રી



### ૧૩. અને ફરી મળીએ તે પહેલાં

‘કુંઈક અંગત – કુંઈક સંગત’

એક ડોક્ટર તરીકે નહીં, એક માનવી માનવીને કહે